



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૭/૦૪/૨૦૧૯ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૧૫/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૯ કેસ કરી, ૩૫ વ્યક્તિઓને ઝડપી, ૨૩૮ લીટર દેશી દારૂ, ૭ બોટલ ઇંગ્લીશ દારૂ, ૪ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ અને ૧ બિયર ટીન કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૫ કેસ કરી ૨૩ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૭૫,૨૮૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૧૬/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૫૫૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૪૪ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૬૧૭/૧૯

ઘાટલોડીયા: રમણીકભાઈ મગનલાલ પારીખ (ઉ.વ.૮૧) (રહે. સારથી વિભાગ-૧ એ-વન સ્કુલ સામે સુભાષચોક પાસે મેમનગર) એ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૫/૪/૧૯ સાજના ૬/૧૫ વાગ્યાના સુમારે કાર ચલાવી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ઉભી રખાવી કારમાં બેસી રમણીકભાઈને કહેલ કે “હું તમારી મહેરબાનીથી મોટો માણસ થયો છું” તેમ કહી રમણીકભાઈને તેની પાસેનું લેપટોપ તથા એપલ કંપનીના ફોન રમણીકભાઈના બેગમા મુકી રમણીકભાઈને વિશ્વાસ અપાવી તેમજ આજે તેનો જન્મદીવસ છે તો તેઓ પોતાના કઈક ગીફ્ટ આપે તેવું કહી ભુયંગદેવ ચાર રસ્તા પાસે આવેલ પંજાબ નેશનલ બેંકનું એ.ટી.એમ.ખાતે લઈ જઈ ૨૦,૦૦૦/- રૂપિયા ઉપડાવી તેમજ રમણીકભાઈ પાસે રોકડ રકમ મળી રૂપિયા ૨૨,૫૦૦/- મેળવી લઈ રમણીકભાઈને આપેલ લેપટોપ તથા એપલ કંપનીના ફોન મેળવી લઈ થેલામા ઇંટ મુકી પર્સમા સાબુ મુકી છેતરપીડી કરી વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી.એ.આર.ડાંગર ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૬૧૮/૧૯

આનંદનગર: કલાવતીબહેન વા/ઓ જયેશકુમાર અખાણી (રહે. શરણમ ૧૦ સાલ્વી હોસ્પિટલ સેલ પેટ્રોલ પંપ સામે આનંદનગર) એ આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૬/૪/૧૯ કલાક ૧૦/૦૦ થી ૧૧/૪૫ વાગ્યા દરમિયાન સતાધાર બીઆરટીએસ બસ સ્ટેન્ડ થી પોતાના રહેણાંક સુધીમાં અજાણી વ્યક્તિએ પોતાના પર્સમાંથી રોકડ રૂપિયા ૩૭,૦૦૦/- ચોરી કરી લીધી હતી. આ ગુનાની તપાસ હે.કો.શ્રી. મનહરભાઈ રૂપાજી ચલાવે છે.

અપમૃત્યુ:-

સમાચાર યાદી નં.૬૧૯/૧૯

કૃષ્ણનગર: કિરણભાઈ ડાહ્યાભાઈ સુથાર (રહે. ન્યુ નંદન સોસાયટી વ્યાસવાડી સામે કઠવાડા રોડ નવા નરોડા) તા.૫/૪/૧૯ રાતના ૧૨/૪૫ વાગ્યાના સુમારે કૃષ્ણનગર ગુજરાત ટેકનોકાસ્ટી કંપની જી.ડી.રોડ ખાતે હેલ્પર તરીકે કામ કરતા હતા ત્યારે મોલ્ડ બોક્ષની પેટી હુકમાથી છટકી જવાથી તેઓના ઉપર પડતા માથામા ગંભીર ઇજાઓ થતા સારવાર માટે આનંદ સર્જિકલ હોપીટલ લઇ જતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતુ. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી વિજયકુમાર મારુતીરાવ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૬૨૦/૧૯

મેઘાણીનગર: રામપ્રકાશ હિરાલાલ દોહર (ઉ.વ.૭૦) (રહે.અમરાજીનગર ગલી નંબર-૨ ભાર્ગવ રોડ મેઘાણીનગર) એ બિમારીથી કંટાળી તા.૬/૪/૧૯ કલાક ૧૦/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે એસીડ પી લીધુ હતુ. સારવાર માટે સીવીલ હોપીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતુ. આ અંગે મેઘાણીનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી લક્ષ્મણભાઈ આભાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.